

B.Com. Semester - 6 (CBCS) Examination**March/April-2024 (OLD COURSE)****AUDITING AND CORPORATE GOVERNANCE -2(DSE-1)****Time: 2:30 Hours****Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧	(A) મિલકતોનું મૂલ્યાંકન અને ચકાસણીનો અર્થ સમજાવો, આ અંગે ઓડિટરની ફરજો જણાવો.	(૧૦)
	(B) ચકાસણી અને મૂલ્યાંકન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.	(૧૦)
	અથવા	
પ્રશ્ન.૧	નીચેની ચકાસણી તમે કઈ રીતે કરશો તે જણાવો.	(૨૦)
	(૧) સંભવિત જવાબદારીઓ (૨) પટે રાખેલ મિલકતો (૩) ડિબેન્યર્સ	
પ્રશ્ન.૨	(A) વહેંચણીપાત્ર નફો એટલે શું? વહેંચણીપાત્ર નફાનાં વિવાદાસ્પદ મુદ્દાઓ ચર્ચો.	(૧૦)
	(B) વહેંચણીપાત્ર નફાને અસર કરતા પરિબલોની ચર્ચા કરો.	(૧૦)
	અથવા	
પ્રશ્ન.૨	(A) વહેંચણીપાત્ર નફા અંગે ઓડિટરની ફરજો જણાવો.	(૧૦)
	(B) ડિવિડન્ડનો અર્થ અને પ્રકારો સમજાવો.	(૧૦)
પ્રશ્ન.૩	ઓડિટ અહેવાલ એટલે શું? ઓડિટ અહેવાલ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો.	(૧૫)
	અથવા	
પ્રશ્ન.૩	ઓડિટ અહેવાલનાં પ્રકારો અંગે સમજૂતી આપો.	(૧૫)
પ્રશ્ન.૪	નૈતિક આચારસંહિતામાં આવરી લેવાયેલ મુદ્દાઓની ચર્ચા કરો.	(૧૫)
	અથવા	
પ્રશ્ન.૪	કંપનીની નૈતિક વર્તણૂકનો ખ્યાલ સમજાવો.	(૧૫)

ENGLISH VERSION

Que.1	(A) Explain the meaning of verification and valuation of assets. State the duties of the auditor in this regard.	(10)
	(B) Specify the difference between verification and valuation.	(10)
	OR	
Que.1	How would you verification the following?	(20)
	(1) Potential liabilities (2) Leased property (3) Debentures	
Que.2	(A) What is divisible profit? Discuss the Controversial Issues of divisible Profits.	(10)
	(B) Discuss the factors affecting divisible profits.	(10)
	OR	
Que.2	(A) State the duties of the auditor regarding divisible profits.	(10)
	(B) Explain the meaning and types of dividend.	(10)
Que.3	What is audit report? State the points to be considered while preparing an audit report.	(15)
	OR	
Que.3	Explain the types of audit reports.	(15)
Que.4	Discuss the issues covered in the code of ethical conduct.	(15)
	OR	
Que.4	Explain company's ethical behavior concept.	(15)
